

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૧૦/૨૦૧૭ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૨૧૦૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૪૬૪ લીટર દેશી દારૂ, ૩૦૪ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૮ ક્વાટર ઈંગ્લીશ દારૂ, ૯૬ બિયર ટીન, ૧ રિક્ષા અને ૧ તુફાન ગાડી કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૨૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૦,૧૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૦૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૧૦૭/૧૭

વાસણા: પ્રિતીબહેન બીપીનભાઈ દરજી (ઉ.વ.૩૯) (રહે. શિલ્પાલય એપાર્ટમેન્ટ ગોદાવરી અંજલી વાસણા) એ તા.૧૭/૧૦/૧૭ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૧૦/૧૭ ૯/૩૦ થી તા.૧૬/૧૦/૧૭ બપોરના ૪/૦૦ સુધીના સમયગાળા દરમિયાન આરોપી મો.નં.૯૦૩૩૭૦૦૪૦૯ ના કાર્ડધારક મનોજ રાઠોડ એ પ્રિતીબહેનને કેનેડા મોકલવાની લાલચ આપી રૂપિયા ૩૪,૮૦૦/- મનોજ રાઠોડના ખાતામાં જમા કરાવડાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જી.જે રાઓલ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૧૦૮/૧૭

જીઆઈડીસી વટવા: નિરવભાઈ દિપકકુમાર શાહ (રહે. શિવ ટેનામેન્ટ કેડિલાબ્રિજ પાસે જોઈતીબા હોસ્પિટલની પાછળ ઘોડાસર) એ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૧૦/૧૭ બપોરના ૧/૧૫ થી ૧/૪૫ વાગ્યા દરમિયાન જીઆઈડીસી વટવા અમદાવાદ મર્કટાઈલ બેન્ક વટવા શાખા આગળ પાર્ક કરેલ પોતાના એક્ટીવાની ડેકીમાંથી જરૂરી કાગળો અને રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એસ.ગોસ્વામી ચલાવે છે.

**કારંજ:** મહેન્દ્રભાઈ બાબુભાઈ (રહે. કૈલાસધામ સોસાયટી હાટકેશ્વર) તા.૧૬/૧૦/૧૭ સાંજના ૭/૦૦ વાગ્યાના સુમારે રીલીફ રોડ ઘી કાટા મકરેદ દેસાઈ મ્યુનીસીપાલટી પે પાર્કીંગના ગેટ નજીકથી પોતાની કાર ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પુરૂષ ગાડી નજીક આવી કહેલ કે તમારી ગાડીમાંથી ઓઈલ ટપકે છે તેમ કહેતા મહેન્દ્રભાઈ ગાડીનું બોનેટ ખોલી જોવા જતા મહેન્દ્રભાઈની નજર ચુકવી ગાડીમાંથી ડેલ કંપનીનું લેપટોપ કિમત રૂપિયા ૩૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૬૫૦૦/- ચોરી કરી લઈ આ પુરૂષ પલાયન થઈ ગયો હતો આ અંગેની ફરીયાદ મહેન્દ્રભાઈએ કારંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ટી.ચોધરી ચલાવે છે.

**સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-**

**સમાચાર યાદી નં.૨૧૦૯/૧૭**

**સેટેલાઇટ:** પાયલબહેન વા./ઓ પ્રશાંતભાઈ શાહ (ઉ.વ.૪૦) (રહે. જીવન જ્યોત સોસાયટી સુંદરવન સોસાયટી ફ્લેટની સામે અકુંર રોડ નારણપુરા ચાર રસ્તા નારણપુરા) તા.૧૭/૧૦/૧૭ બપોરના ૧૨/૩૦ વાગ્યાના સુમારે શીવરંજની બ્રીજના ઉતરતા બ્રીજના છેડેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ એક પુરૂષ પાયલબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિમત રૂપિયા ૬૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ પાયલબહેન શાહે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.ઝાલા ચલાવે છે.

**કૃષ્ણનગર:** કિષ્ણાબહેન વા./ઓ નિલેશકુમાર સોલંકી (ઉ.વ.૩૧) (રહે.અશ્વલેષા પાર્ક સોસાયટી જી.ડી.હાઇસ્કૂલની પાસે સૈજપુર કૃષ્ણનગર) તા.૧૭/૧૦/૧૭ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે જીડી હનુમાનજી મંદિર નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ કિષ્ણાબહેન ગળામાંથી સોનાની ચેઈન પેડલ સાથે કિમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ કિષ્ણાબહેન સોલંકીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી વી ખરાડી ચલાવે છે.

**વાહન ચોરી:-**

**સમાચાર યાદી નં.૨૧૧૦/૧૭**

**ઓઢવ:** બાબુભાઈ નુરાભાઈ વહોનીયા (રહે.કિશ ઇલાઇટ ફ્લેટોની સ્કિમ રીંગરોડ ઓઢવ) એ તા.૧૬/૧૦/૧૭ કલાક ૧૨/૧૫ વાગે રહેણાંક નજીક પોતાની બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૨૦ વી ૭૮૯૯ કિમત રૂપિયા ૬,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી કલાક ૬/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ બાબુભાઈ વહોરીયાએ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એન.ખાંટ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.